

Seat No. : \_\_\_\_\_

**DC-106**

December-2013

**B.Com. (CBCS) Sem.-III**

**CC-205 : Fundamental Statistics – I**

**(Compulsory Subject)**

**(New)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70]**

**સૂચના :** (1) જમણી તરફના આંકડા ગુણ દર્શાવે છે.

**Instructions :** Figures to the right denotes marks

(2) સાધા ગણનયંત્રનો ઉપયોગ કરી શકાશે.  
Simple calculator can be used.

1. (a) સમજાવો :

4

Explain :

(i) સમાન વિધેય

Equal Function

(ii) વિધેયનું સતત્ય

Continuity of a function

અથવા/OR

(a) અર્થ સમજાવો :

Explain meaning of

(i)  $\lim_{x \rightarrow a} f(x) = l$

(ii)  $x \rightarrow 0$

(iii)  $x \rightarrow \infty$

(b) એક વस્તુના  $x$  એકમો માટેના ઉત્પાદન ખર્ચનું વિધેય  $C = 50x + 600$  છે અને પ્રતિ એકમ વેચાણકિમત ₹ 65 છે. સમતૂટ બિંદુ અને ₹ 900 નફો મેળવવા કેટલા એકમો ઉત્પાદિત કરવા પડે તે શોધો.

5

The cost function of producing  $x$  units of an item is  $C = 50x + 600$  and the selling price per unit is ₹ 65. Find break-even point and the number of units to be produced to get profit of ₹ 900.

અથવા/OR

જો  $f(x) = 5x^2 + 5x$ , હોય તો  $\lim_{h \rightarrow 0} \frac{f(5+h) - f(5)}{h}$  શોધો.

If  $f(x) = 5x^2 + 5x$ , then find  $\lim_{h \rightarrow 0} \frac{f(5+h) - f(5)}{h}$

(c) ગમે તે એકનો જવાબ આપો :

Attempt any one :

$$(i) \lim_{x \rightarrow 2} \frac{\sqrt{x+2} - \sqrt{3}}{x-1} મેળવો.$$

$$\text{Find } \lim_{x \rightarrow 2} \frac{\sqrt{x+2} - \sqrt{3}}{x-1}$$

(ii)  $x = 4$  આગળ સતત્યની ચર્ચી કરો.

Discuss the continuity at  $x = 4$

$$f(x) = \begin{cases} \frac{x^2 - 16}{x - 4} & ; x \neq 4 \\ 8 & ; x = 4 \end{cases}$$

2. (a) વિકલનની વ્યાખ્યા આપો અને વ્યાખ્યાની મદદથી વિધેય  $f(x) = \sqrt{x+2}$  નું વિકલન મેળવો. 4  
Define derivative and using the definition, obtain derivative of the function  $f(x) = \sqrt{x+2}$ .

અથવા/OR

વિકલનના નિયમો લખો.

Write the rules of Derivatives.

(b) નીચેના માટે  $\frac{dy}{dx}$  મેળવો :

Obtain  $\frac{dy}{dx}$  of the following :

$$(i) \quad y = \frac{1}{x^4} - \frac{1}{x^3} + \frac{1}{x^2} - 2x + 10$$

$$(ii) \quad y = \frac{x^2 + 3x + 5}{\log x}$$

અથવા/OR

(b) નીચેના માટે  $\frac{dy}{dx}$  મેળવો :

Obtain  $\frac{dy}{dx}$  of the following :

$$(i) \quad y = \left[ x + \frac{4x+8}{x+2} \right] \left[ x + \frac{3x+9}{x+3} \right]$$

$$(ii) \quad xy + 6y + 4x - 2 = 0$$

10

જો  $f(x) = 5x^2 + 5x$ , હોય તો  $\lim_{h \rightarrow 0} \frac{f(5+h) - f(5)}{h}$  શોધો.

If  $f(x) = 5x^2 + 5x$ , then find  $\lim_{h \rightarrow 0} \frac{f(5+h) - f(5)}{h}$

(c) ગમે તે એકનો જવાબ આપો :

Attempt any one :

$$(i) \lim_{x \rightarrow 2} \frac{\sqrt{x+2} - \sqrt{3}}{x-1} મેળવો.$$

$$\text{Find } \lim_{x \rightarrow 2} \frac{\sqrt{x+2} - \sqrt{3}}{x-1}$$

(ii)  $x = 4$  આગળ સતત્યની ચર્ચી કરો.

Discuss the continuity at  $x = 4$

$$f(x) = \begin{cases} \frac{x^2 - 16}{x - 4} & ; x \neq 4 \\ 8 & ; x = 4 \end{cases}$$

2. (a) વિકલનની વ્યાખ્યા આપો અને વ્યાખ્યાની મદદથી વિધેય  $f(x) = \sqrt{x+2}$  નું વિકલન મેળવો. 4

Define derivative and using the definition, obtain derivative of the function  $f(x) = \sqrt{x+2}$ .

અથવા/OR

વિકલનના નિયમો લખો.

Write the rules of Derivatives.

(b) નીચેના માટે  $\frac{dy}{dx}$  મેળવો :

10

Obtain  $\frac{dy}{dx}$  of the following :

$$(i) \quad y = \frac{1}{x^4} - \frac{1}{x^3} + \frac{1}{x^2} - 2x + 10$$

$$(ii) \quad y = \frac{x^2 + 3x + 5}{\log x}$$

અથવા/OR

(b) નીચેના માટે  $\frac{dy}{dx}$  મેળવો :

Obtain  $\frac{dy}{dx}$  of the following :

$$(i) \quad y = \left[ x + \frac{4x+8}{x+2} \right] \left[ x + \frac{3x+9}{x+3} \right]$$

$$(ii) \quad xy + 6y + 4x - 2 = 0$$

3. (a) (i) પ્રતીપ સંભાવના માટેનો બેઈજનો પ્રમેય જણાવો.  
 State Bayes' theorem of Inverse Probability.
- (ii) સંભાવનાની ગાણિતીય વ્યાખ્યા આપો અને સાબિત કરો કે  $0 \leq P(A) \leq 1$ .  
 Give mathematical definition of probability and prove that  $0 \leq P(A) \leq 1$ .
- અથવા/OR
- (a) ઉદાહરણ આપી સમજાવો :  
 Explain with illustration :
- (i) યદૃચ્છ પ્રયોગ  
 Random Experiment
- (ii) પરસ્પર નિવારક ઘટનાઓ  
 Mutually Exclusive Events
- (b) સંભાવનાનો એક દાખલો ત્રણ વિદ્યાર્થીઓ A, B અને C ને આપવામાં આવે છે. દાખલો સાચો ગણે તેની સંભાવના તેમની અનુક્રમે  $\frac{1}{2}, \frac{3}{4}$  અને  $\frac{2}{3}$  છે. દાખલો સાચો ગણે તેની સંભાવના શોધો. 5  
 An example of probability is given to three students A, B & C. Their probability of solving the example correctly are respectively  $\frac{1}{2}, \frac{3}{4}$  &  $\frac{2}{3}$ . Find probability that the example will be solved correctly.
- અથવા/OR
- જો  $2P(A) = 3P(B) = 5P(A \cap B) = \frac{1}{3}$  હોય તો
- (i)  $P(A \cup B)$   
 (ii)  $P(B|A')$  ની કિંમત મેળવો.
- If  $2P(A) = 3P(B) = 5P(A \cap B) = \frac{1}{3}$ , then find value of
- (i)  $P(A \cup B)$   
 (ii)  $P(B|A')$
- (c) ત્રણ વ્યક્તિ A, B અને C માંથી વાઈસ ચાન્સેલરની પસંદગી કરવાની છે. તેમની પસંદગીની તક અનુક્રમે 4 : 2 : 3 ના પ્રમાણમાં છે. તે ત્રણ વ્યક્તિઓ નવા રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરે તેની સંભાવનાઓ અનુક્રમે  $\frac{1}{2}, \frac{1}{3}$  અને  $\frac{1}{5}$  છે. વ્યક્તિ A પસંદ થાય અને નવા અભ્યાસક્રમને પ્રોત્સાહન મળે તેની સંભાવના શોધો. 5  
 A vice-chancellor is to be chosen from three persons A, B & C. Their chances of selection are respectively in the proportion 4 : 2 : 3. The probabilities that the new employment oriented courses will be started by three persons are respectively  $\frac{1}{2}, \frac{1}{3}$  &  $\frac{1}{5}$ . Find the probability that new courses are encouraged if person A is selected.
- અથવા/OR

એક ડબામાં 5 સફેદ, 4 લાલ અને 3 કાળા દડા છે. ત્રણ દડા તેમાંથી યદૃચ્છ રીતે લેવામાં આવે છે.

- (i) બધા જ દડા કાળા હોય
- (ii) બધા જ દડા જુદા રંગના હોય તેની સંભાવના શોધો.

An urn contains 5 white, 4 red and 3 black balls. Three balls are drawn at random from it. Find the probability that

- (i) All are black balls
- (ii) All are of different colours balls.

4. (a) અસતત ચલની ગાણિતીય અપેક્ષાની વાખ્યા આપો અને અપેક્ષિત કંમતના કોઈપણ ત્રણ ગુણધર્મો લખો.

4

Define Mathematical Expectation of a discrete variable and write any three properties of expected value.

અથવા/OR

વાખ્યા આપો :

Define :

- (i) કેન્દ્રીય પ્રધાતો  
Central Moments
- (ii) સાદી પ્રધાતો  
Raw Moments
- (iii) વિષમતા  
Skewness
- (iv) ઘંટાકારતા  
Kurtosis

- (b) 2, 4, 6 અને 8 અવલોકનો માટે પ્રથમ ચાર કેન્દ્રીય પ્રધાતો મેળવો.

5

Find first four central moments of the observations 2, 4, 6 & 8.

અથવા/OR

એક પેકેટમાં 10 સ્કૂ છે જે પૈકી 2 સ્કૂ ખામીવાળા છે. જો 2 સ્કૂ યદૃચ્છ રીતે લેવામાં આવે તો ખામીવાળા સ્કૂની અપેક્ષિત સંખ્યા શોધો અને તેનો વિચરણ પણ મેળવો.

There are 10 screws in a packet of which 2 screws are defective. If 2 screws are taken at random, find the expected number of defective screws and also obtain its variance.

- (c) ઉગમબિંદુની આજુબાજુ પ્રથમ ચાર સાદી પ્રધાતો 1.5, 17, -30 અને 118 છે. પ્રથમ ચાર કેન્દ્રીય પ્રધાતો અને મધ્યક શોધો.

5

The first four raw moments about origin of a frequency distribution are 1.5, 17, -30 and 118. Find first four central moments and mean.

અથવા/OR

જો  $E(x) = 4$ ,  $V(x) = 1$  હોય તો  $E(x+1)^2 V(3x+5)$  અને  $V(3x-5)$  શોધો.

If  $E(x) = 4$ ,  $V(x) = 1$ , find  $E(x+1)^2 V(3x+5)$  &  $V(3x-5)$ .

5. પોત્ય જવાબ પસંદ કરો :

Choose proper answer :

(1) જો  $f(x) = x^3$ ,  $g(x) = 3x^2 - 2x$ ,  $x \in \{0, 1, 2\}$  હોય તો  $f$  અને  $g$  \_\_\_\_\_ વિધેય છે.

- (a) સમાન
- (b) એક-એક
- (c) અનેક-એક

If  $f(x) = x^3$ ,  $g(x) = 3x^2 - 2x$ ,  $x \in \{0, 1, 2\}$  then  $f$  and  $g$  are \_\_\_\_\_ function.

- (a) equal
- (b) one-one
- (c) many one

(2) જો  $f(x) = \frac{1}{2x+5}$  હોય તો  $f'(1) =$  \_\_\_\_\_.

- (a)  $\frac{1}{7}$
- (b)  $\frac{-1}{49}$
- (c)  $\frac{-2}{49}$
- (d) એકપણ નહિ

If  $f(x) = \frac{1}{2x+5}$  then  $f'(1) =$  \_\_\_\_\_.

- (a)  $\frac{1}{7}$
- (b)  $\frac{-1}{49}$
- (c)  $\frac{-2}{49}$
- (d) none of above

(3)  $\lim_{x \rightarrow 0} \frac{2x^3 - 4x^2 + 5x}{4x^2 + 5x} =$  \_\_\_\_\_.

- (a) 0
- (b)  $\infty$
- (c) 1
- (d) એકપણ નહિ

$\lim_{x \rightarrow 0} \frac{2x^3 - 4x^2 + 5x}{4x^2 + 5x} =$  \_\_\_\_\_.

- (a) 0
- (b)  $\infty$
- (c) 1
- (d) none of above

(4)  $x = 1$  આગળ  $f(x) = \frac{x^2 - 4x + 3}{x^2 - 7x + 6}$  \_\_\_\_\_ થાય.

- (a) સતત
- (b) અસતત
- (c) એકપણ નહિ

At  $x = 1$ ,  $f(x) = \frac{x^2 - 4x + 3}{x^2 - 7x + 6}$  is \_\_\_\_\_.

- (a) continuous
- (b) not continuous
- (c) none of above

- $$(5) \quad \text{જે } P(A) = 2, P(B) = P(A | B) = 0.6 \text{ હોય તો } P(A \cap B) = \underline{\hspace{2cm}}.$$



If  $P(A) = 2$   $P(B) = P(A | B) = 0.6$  then  $P(A \cap B) = \underline{\hspace{2cm}}$ .



- (6) યદૃચ્છા ચલ  $x$  નું સંભાવના ઘટત્વ વિધેય

$$P(x) = K(x + 3), x = -1, 0, 1$$

= 0 અન્યથા હોય તો K કિંમત \_\_\_\_\_ થાય.

- (a)  $\frac{1}{9}$       (b) 0.1  
(c) 10      (d) એકપણી નાણ

The probability mass function of a random variable  $x$  is

$$P(x) = K(x + 3), x = -1, 0, 1$$

= 0 elsewhere than value of K = \_\_\_\_\_.

- (a)  $\frac{1}{9}$       (b) 0.1  
(c) 10      (d) none of above

- (7) જો  $\mu_2 = 2$ ,  $\mu_3 = 4$ ,  $\mu_4 = 16$  હાય તો વિષમતા ( $\beta_1$ ) અને ધંટાકારતા ( $\beta_2$ ) \_\_\_\_\_ અને થાય.

- (a) 2      (b)  $\frac{1}{2}$   
(c) 4      (d)  $\frac{1}{4}$

If  $\mu_2 = 2$ ,  $\mu_3 = 4$ ,  $\mu_4 = 16$  then skewness ( $\beta_1$ ) and Kurtosis ( $\beta_2$ ) will be \_\_\_\_\_

1

- (a) 2      (b)  $\frac{1}{2}$   
(c) 4      (d)  $\frac{1}{4}$